

ત્વરિત જાહેરાત માટે

હેલોવીન ઉજવવાના દિવસો આવી રહ્યાં છે! બ્રમ્પટનમાં આ વર્ષે બિહામણા અને સુરક્ષિત રહેવું

બ્રમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 13, 2021) – હેલોવીન આવવાની તૈયારીમાં છે અને દરેક વ્યક્તિ આ વર્ષે યુક્તિ અજમાવીને બિહામણો દેખાવ કરીને મોજમજ કરવા સુરક્ષિતપણે બહાર રાઉન્ડ લેવા રોમાંચિત છે.

આ વર્ષે ઉજવણી કરતી વખતે, રહેવાસીઓને આરોગ્ય અને સુરક્ષાને સર્વોત્તમ ધ્યાનમાં રાખવાનું કહેવામાં આવે છે. ટ્રિક-ઓર-ટ્રિટર્સ (પરંપરાગત હેલોવીન વેશભૂષા પહેરનારાઓને) નીચેની બાબતો કહેવામાં આવે છે:

- બીમાર હો તો ઘરે રહો.
- ટ્રિક-ઓર-ટ્રિટ શક્ય એટલું વધારે આઉટડોર્સમાં કરો.
- રચનાત્મક બનીને વેશભૂષામાં ફેસ કવરિંગ્સ બનાવો! યાદ રાખશો કે કોસ્ચુમ મારસ્ક એ ફેસ કવરિંગનો વિકલ્પ બનતો નથી. કોસ્ચુમ મારસ્ક નોન-મેડિકલ મારસ્ક કે ફેસ કવરિંગ પર પહેરવો જોઈએ નહિ કારણ કે તે ભયજનક બની શકે છે જો તેનાથી કોસ્ચુમ મારસ્ક શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરે.
- ઘરના ઉંબરે ભીડ ના કરશો – વારા પ્રમાણે અવરજવર કરો, એક પછી એક.
- મિજબાની કરાવતા લોકો સાથે સંવાદ ટૂંકમાં કરો.
- સારા સ્વચ્છતા શાસ્ત્રનો મહાવરો કરો અને હેન્ડ સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરો.

જો મિજબાની કરાવવાના હો તો:

- હેલોવીન ઉજવણીઓમાં સહભાગી ન થાવ જો બીમાર હો.
- ટ્રિક-ઓર-ટ્રિટર્સ (પરંપરાગત હેલોવીન વેશભૂષા પહેરનારાઓ) સાથે સંવાદ ટૂંકમાં કરો.
- વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવી ન શકાય ત્યારે ફેસ કવરિંગ પહેરવાનું વિચારો.
- ફેસ કવરિંગને કોસ્ચુમના ભાગ તરીકે સમાવવાનું વિચારો.
- માત્ર ખરીદવા અને પેકિંગવાળા ખાદ્યપદાર્થોની મિજબાની કરાવો.
- ટ્રિક-ઓર-ટ્રિટર્સને પોતાની મિજબાનીઓ માટે ગાવા કે બૂમો પાડવા ન કહો.
- સાબુ અને પાણીનો ઉપયોગ કરીને અથવા હેન્ડ સેનિટાઈઝર વડે સમગ્ર સાંજ દરમિયાન હાથ વારંવાર સાફ કરતા રહો.

હેલોવીનમાં સુરક્ષા

હેલોવીનની ભાવનામાં પ્રવેશતી વખતે સચેત રહો, આગના જોખમો ટાળો અને ઈજાઓ રોકો.

એક કોસ્ચુમ પસંદ કરતી વખતે:

- કોસ્ચુમ ભરાઈ જતું કે પડી જવાનું ટાળવા ટૂંકું રાખો.
- આગની જ્વાળા અવરોધતા કોસ્ચુમ્સ અને એક્સેસરીસ પસંદ કરો.
- સારી રીતે પ્રકાશિત રહો. મોટરિસ્ટ્સ સ્પષ્ટપણે જોઈ શકે તેવા તેજસ્વી રંગના કોસ્ચુમ્સ પસંદ કરો.

સજાવટ કરતી વખતે:

- સૂકા ફૂલો, કોર્નસ્ટોકસ (મકાઈના ડુંડા) અને કાગળ બહુ સહેલાઈથી આગ પકડી શકે છે. સજાવટને પ્રજ્વલિત જ્વાળા અને ગરમીના સ્ત્રોતોથી દૂર રાખો.
- બહાર નીકળવાના માર્ગો પરથી સજાવટ અને અવરોધો કાઢી નાખો.
- તમારા જૅક-ઓ-લેન્ટર્નને બેટરી સંચાલિત મીણબત્તીઓથી અથવા સળગાવેલી મીણબત્તીઓને બદલે ગ્લો સ્ટિક્સથી પ્રકાશિત કરો.
- અથડાવાના કે ભરાવાના જોખમો દૂર કરો અને ટ્રિક-ઓર-ટ્રિટર્સને સુરક્ષિત રાખવા બહારની વાઈટો ચાલુ રાખો.
- ખાતરી કરો કે ઘરમાંના બધાં સ્મોક એલાર્મ્સ યોગ્ય રીતે કાર્યરત છે.

ટ્રીટ એક્સેસિબલિટી

"બ્રેમ્પટન એક રચના (મોડેર્ન) છે, અને સીટી ઓફ બ્રેમ્પટન પ્રવેશ સુલભતા વધારવાની અને પોતાના વૈવિધ્યસભર સમગ્ર સમુદાયમાં સૌ માટેની સમજ કેળવવાની તકો ઓળખી કાઢવા સમર્પિત છે. આ વર્ષની શરૂઆતમાં, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે ટ્રિક-ઓર-ટ્રીટ્સની અવરોધ-રહિત અને પ્રવેશ સુલભ રીતોને પ્રોત્સાહિત કરવા પોતાના સાર્ન બાય-લોમાં સુધારો કરવાની મંજૂરી આપી. બ્રેમ્પટનમાં મકાનમાલિકોને પોતાના ઘર સામેની લોન પર ટ્રીટ એક્સેસિબલિટી સાર્ન મૂકવા માટે આવકારવામાં આવે છે જેથી રહેવાસીઓને ખબર પડે કે જો ટ્રિક-ઓર-ટ્રીટ્સ અશક્તતા ધરાવતી વ્યક્તિ હોય તો, તેઓ યજમાનના ઘરે કોઈ અવરોધ વિના હલોવીનનો અનુભવ કરી શકે છે.

ટ્રીટ એક્સેસિબલિટી મકાનમાલિકોને નીચેના સૂચનો પણ જાણાવે છે:

- ખાતરી કરો કે ટ્રિક-ઓર-ટ્રીટ્સ વિસ્તારનો માર્ગ સારો એવો પ્રકાશિત છે.
- ડ્રાઈવવે અને પાથવે સાફ રાખો
- ટ્રિક-ઓર-ટ્રીટ્સ માટે ડ્રાઈવવે પર વધારે સારી પ્રવેશ સુલભતા થવા દેવા કાર્સને ડ્રાઈવવે પરથી દૂર રાખો
- ડ્રાઈવવેના અંતે, ગેરેજ કે વાહનની ટ્રેક બહાર ટ્રિક-ઓર-ટ્રીટ સ્ટેશન બનાવો.
- સ્ટ્રોબ લાઈટ્સ કે ઊંચો અવાજવાળો, અચાનક તીવ્ર ઘોંઘાટનો ઉપયોગ કરવાથી દૂર રહો.
- પાળેલા પ્રાણીઓને સુરક્ષિત અને સલામત રાખો.

ટ્રીટ એક્સેસિબલિટી પર વધુ માહિતી માટે વેબસાઈટ www.treataccessibly.com જુઓ. સીટીમાં એક્સેસિબિલિટી પર વધુ માહિતી માટે વેબસાઈટ www.brampton.ca/accessibility જુઓ.

ભયભરી રાતો (ફાઈટનિંગ નાઈટ્સ)

રૂબરૂમાં ભયભીત રાતો ઓક્ટોબર 16, 22, 23 અને 29 નાં રોજ સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી પસંદગીના બ્રેમ્પટન રિક્રિએશન સેન્ટર્સમાં ફ્રીથી શરૂ થશે. નોંધણી અનિવાર્ય છે અને પ્રવેશ મફત છે. કંઈક સ્પૂક્ટેક્યુલર કોટ્ટેબિક મજા માટે અમારી સાથે જોડાવો જેમાં સામેલ છે:

- સ્પૂકી ફેમિલી મૂવી નાઈટ *
- વેગન નાઈટ્સ*
- Zombie Zumba™ (ઝોમ્બી ઝુમ્બા)
- અંરબ્રશ ટેટૂ
- કાફ્ટ્સ (હસ્તકળા)
- મનોરંજન
- માર્શમેલો રોસ્ટિંગ

*સ્થળો પસંદ કરો

બ્રેમ્પટન રિક્રિએશન ઓક્ટોબર 13, 20 અને 29 નાં રોજ પસંદગીના રિક્રિએશન સેન્ટર્સમાં સ્પૂકી સ્વીમ એન્ડ સ્કેટ્સનું આયોજન પણ કરશે. ફાઈટ નાઈટ્સ એન્ડ સ્પૂકી સ્વીમ એન્ડ સ્કેટ્સ માટે નોંધણી કરાવવા, [અહીં ક્લિક કરો](#).

પમ્પકિન પાર્ટી

ફ્રીથી થવાની છે અને અગાઉ ક્યારેય કરતા વધારે સારી રીતે – પમ્પકિન પાર્ટી હલોવીનની ભાવનાને વધુ એક દિવસ માટે જીવંત રાખે છે! તમારું કોસ્ચ્યુમ પહેરો અને તમારું પમ્પકિન નવેમ્બર 1 નાં રોજ સાંજે 4 થી 8 વચ્ચે કેન બિલ્ડન્સ સ્કવેરમાં લાવો. એનિવરોડ્સનું જીવંત મનોરંજન, અને પોપકોર્ન અને ગરમ એપલ સાઈડર સહિત ફ્રી ગીવઅવેસ માણો. આ આયોજન પછી કોળાનું ખાતર બનાવવામાં આવશે.

મોજમજા કરતી વખતે સુરક્ષિત રહો. માસ્ક્સ પહેરવા કડકપણે પ્રોત્સાહિત કરવામાં આવે છે ખાસ કરીને જ્યારે વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું શક્ય ન હોય. પમ્પકિન પાર્ટીના ઉદાર દિલ પ્રાયોજક સ્વિસ શેલે (Swiss Chalet) છે. વિગતો માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/recreation

કુશળ પહેરવેશ સ્પર્ધા

તમને મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) અને બ્રેમ્પટન સીટી કાઉન્સિલના સભ્યો દ્વારા આયોજિત 2021 હલોવીન કાફ્ટી કોસ્ચ્યુમ સ્પર્ધામાં સહભાગી થવા આમંત્રિત કરવામાં આવે છે. તમારી રચનાત્મક અને બિહામણી બાજુ દેખાડો – ઓક્ટોબર 31 નાં રોજ સાંજે 8 વાગ્યા સુધી તમે પહેરેલા તમારા કોસ્ચ્યુમનો ફોટો પોસ્ટ કરવા #BramptonCraftiestCostume2021 નો ઉપયોગ કરો અથવા ઈમેઈલથી events@brampton.ca ને મોકલો. વિજેતાઓની જાહેરાત નવેમ્બર 1 નાં રોજ કરવામાં આવશે. સહભાગીઓની ઉંમર 10 વર્ષ અને ઓછી હોવી રહી.

સ્પર્ધાના નિયમો અને પાત્રતા વેબસાઇટ brampton.ca/recreation પર જોઈ શકાય છે

અવતરણો (ક્વોટ્સ):

“હું રોમાંચિત છું કે આપણાં રહેવાસીઓ ફરીથી આ વર્ષે હેલોવીનની ઉજવણી કરવાના છે, અને હું બ્રમ્પટનવાસીઓને સીટીની સ્પૂકી ફનની બધી ઓફરોનો લાભ લેવા પ્રોત્સાહિત કરું છું. ફાઈટ નાઈટ્સથી માંડીને, ક્રાફ્ટી કોસ્ચુમ કન્ટેસ્ટ, મોટી પમ્પકિન પાર્ટી સુધી, દરેક વ્યક્તિએ મજા માણવા જેવું ઘણું બધું છે. ઉજવણી કરતી વખતે કૃપા કરી આપણાં સમુદાયનું આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખશો. અને બધાં રહેવાસીઓને – હું તમને હેલોવીનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું!”

– પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“બ્રમ્પટન એક મોઝેઈક (રચના) છે, અને સીટી ઓફ બ્રમ્પટનની અને રીજીયન ઓફ પીલની એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટીસના સભ્ય તરીકે, મને ગૌરવ છે કે આપણી કાઉન્સિલે ટ્રીટ એક્સેસિબિલિટી પ્રોગ્રામને સહાયરૂપ થવા આપણાં સાઈન બાય-લોમાં સુધારો કર્યો છે. હું બ્રમ્પટનવાસીઓને ટ્રીટ એક્સેસિબિલિટી ચિલ્ડ ગૌરવપૂર્વક પોતાના ઘરની ફ્રન્ટ લોનમાં મૂકવા પ્રોત્સાહિત કરું છું, અને આપણાં સમુદાયના બાળકો સુરક્ષિત, પહોંચ સુલભ અને સર્વગ્રાહી બને તેવું ઈચ્છું છું, અને હેપી હેલોવીન.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; સભ્ય, સીટી ઓફ બ્રમ્પટન એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી; સભ્ય, રીજીયન ઓફ પીલ એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી

“મને આ વર્ષે પમ્પકિન પાર્ટી પરત આવતી જોવામાં બહુ ખુશી થાય છે. બ્રમ્પટન એક હરિયાળુ શહેર છે અને આ આયોજન રહેવાસીઓને વધુ એક વખત ન કેવળ પોતાની કોતરણીની આવડતોને પ્રદર્શિત કરવાની પણ પોતાના પમ્પકિન્સનું ખાતર બનાવીને યોગ્ય રીતે નિકાલ કરવાની તક પણ આપે છે. કેટલાક ચડિયાતા ઈનામો જીતવા તમ માટે ક્રાફ્ટી કોસ્ચુમ સ્પર્ધામાં પણ સહભાગી થવાનું ભૂલશો નહીં.”

- હરકિરત સિંહ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10; પ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રમ્પટન

“હેલોવીન ફરી આવવાનું છે અને તેથી આપણાં રૂબરૂ સ્પૂકટેક્યુલર આયોજનો, બિલામણી રાતો અને મોટી પમ્પકિન પાર્ટી પણ ફરી થશે. હું દરેક વ્યક્તિને સુરક્ષિત રીતે ઉજવણી કરવા, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવા, અને તે શક્ય ન હોય ત્યારે મારસ્ક પહેરવા પ્રોત્સાહિત કરું છું. હેપી હેલોવીન, બ્રમ્પટન!”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક :

પ્રભજોત કૈથ (Prabhjot Kainth)
કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ
સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન
સીટી ઓફ બ્રમ્પટન
905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca